https://archive.org/details/bk299/page/n0/mode/1up

2006-08-12 -ABKKPS -Gnati Reet Rivaj Niyam (299)

All Items on https://archive.org/details/realpatidar

tidar.com

Full Library on https://realpatidar.com/library

॥ શ્રી ઉમિયાયે નમઃ ॥

# શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

# જ્ઞાતિ રીતરિવાજોને લગતા નિયમો

❀ મુખ્ય કાર્યાલય ❀

પાટીદાર વિદ્યાર્થી ભવન

નખત્રાણા - કચ્છ. પીન : ૩૭૦ ૬૧૫

ફોન : (૦૨૮૩૫) ૨૨૧૦૪૯, ૨૯૨૭૦૦ ફેક્સ : ૨૨૨૧૪૯

કિંમત રૂ. ૧૦/-

realpatidar.com

https://archive.org/details/bk299/page/n1/mode/1up

# Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk299/page/n2/mode/1up

2006-08-12 -ABKKPS -Gnati Reet Rivaj Niyam (299)

realpatidar.com

।। શ્રી ઉમિયાયે નમઃ ।।

# શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

# જ્ઞાતિ રીતરિવાજોને લગતા નિયમો

❀ મુખ્ય કાર્યાલય ❀

**પાટીદાર વિદ્યાર્થી ભવન**

નખત્રાણા - કચ્છ. પીન : ૩૭૦ ૬૧૫

ફોન : (૦૨૮૩૫) ૨૨૧૦૪૯, ૨૯૨૭૦૦ ફેક્સ : ૨૨૨૧૪૯

કિંમત રૂા. ૧૦/-

realpatidar.com

https://archive.org/details/bk299/page/n3/mode/1up



realpatidar.com

# નિવેદન

વ્હાલાં જ્ઞાતિજનો,

આપસૌ જાણો છો તેમ આપણી જ્ઞાતિનાં ભાઈ બહેનો કચ્છ, ગુજરાત તેમજ ભારત ભરના જુદા-જુદા પ્રાંતોમાં ધંધાર્થે ગયેલ ત્યાંજ વસવાટ કરતા થયેલ. જુદા-જુદા વિસ્તારમાં વસવાટ કરતાં જ્ઞાતિજનોમાં એકવાયતા, સંપ, સંઘઠન જળવાઈ રહે તેના માટે આપણા પૂર્વ વડીલોએ મંથન કરેલ જેમાં મુખ્ય સમાજના ભાઈ-બહેનના લગ્ન મરણ કે કોઈ પણ શુભ/અશુભ પ્રસંગોએ પાળવાના રીત રિવાજના નિયમો બનાવવાનું જરૂરી લાગેલ.

ઉપરોક્ત ઉદ્દેશોને પહોંચી વળવા પ્રથમ તા. ૧/૫/૧૯૬૦ ના મળેલ સમાજના પ્રથમ અધિવેશનમાં મુદ્દાવાઈઝ ચર્ચાઓ કરી સત્તર ઠરાવો તૈયાર કરવામાં આવેલ જે અધિવેશનમાં હાજર સૌ જ્ઞાતિજનો વચ્ચે ઠરાવ વાઈઝ વંચાણે લઈ પાસ કરાવવામાં આવેલ.

ત્યાર બાદ સમયોચીત આ ઠરાવોમાં ફેરફાર કરવાની ફરજ પડેલ તે મુજબ ક્રમશ મળેલ અધિવેશનોમાં તેમાં સુધારા-વધારા સાથે પસાર કરવામાં આવેલ જેને જ્ઞાતિજનોએ માન્યતા આપેલ આમ છેલ્લે તા. ૩૦/૪/૧૯૯૩ ના અધિવેશનમાં સુધારા - વધારા સાથે ઠરાવો પાસ કરેલ જેને સારો એવો સમય પણ થઈ ગયેલ હોઈ અને નજીકમાં અધિવેશન મળે એવી શક્યતા ન લાગતાં તેમજ અત્યારના ઝડપી યુગમાં આ ઠરાવોમાં સુધારા - વધારા કરવાનું જરૂરી લાગતા કારોબારી મીટીંગમાં ચર્ચા કર્યા પછી દરેક ઝોનો તેમજ સમાજો પાસેથી મંતવ્યો મંગાવેલ અને જુદી-જુદી સમાજો અને ઝોનો માંથી આવેલ મંતવ્યો ઉપરથી મુસદો નક્કી કરવા માટે એક સમિતિ બનાવેલ જે સમિતિએ તૈયાર કરેલ મુસદાનું તા. ૧૨/૮/૨૦૦૬ ના

realpatidar.com

https://archive.org/details/bk299/page/n4/mode/1up



realpatidar.com

મળેલ સામાન્ય સભામાં ઠરાવ (મુદ્દા) વાઈઝ વાંચન કરી જરૂરી લાગે ત્યાં સુધારા કરી ૧૯ ઠરાવ પસાર કરવામાં આવેલ જે ઠરાવોની બુક સ્વરૂપે આપસૌ સમક્ષ મુકતા આનંદ અનુભવું છું.

દરેક સમાજના અગ્રણીઓ, મહીલા મંડળ અને યુવક સંઘના હોદ્દેદારોને વિનંતી કે આ ઠરાવો આજના સમયને અનુરૂપ અને જ્ઞાતિના ગરીબ-તવંગર સર્વેને પોસાઈ શકે અને સમાજે આપેલ નિતિનિયમો અપનાવી શકે એ હેતુથી આ ધારા-ધોરણ તૈયાર કરવામાં આવેલ છે તેનો પુરે પુરો અમલ થાય તેવા પ્રયત્નો કરશો. સમાજ તરફથી આપવામાં આવતી કાર્યવાહી દરેક જ્ઞાતિજનોએ નિષ્ઠાથી પાલન કરતાં આવેલ છે તેજ રીતે આ ધારા-ધોરણને અમલમાં લાવવા પુરતો સાથ અને સહકાર આપશે એજ અભ્યર્થના સાથે.

**આપનો**
**વાલજીભાઈ શીવજીભાઈ વાડીયા**
પ્રમુખશ્રી
**શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ**

realpatidar.com

https://archive.org/details/bk299/page/n5/mode/1up



realpatidar.com

# શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

## તા. ૧૨/૦૮/૨૦૦૬ ની સામાન્ય સભામાં પસાર થયેલ જ્ઞાતિ રીતરિવાજોને લગતા નિયમો

**ઠરાવ નં. ૧ જ્ઞાતિના રીતરિવાજોના ઠરાવો અંગે :**

તા. ૩૦-૪-૧૯૯૩ ના ચતુર્થ અધિવેસનમાં જ્ઞાતિ રીતરિવાજોના ઠરાવો પસાર કરેલ જેમાં ૧૩ વર્ષ બાદ તા. ૧૨/૮/૨૦૦૬, સમય ૯:૦૦ કલાકે. મળેલ સમાજની વાર્ષિક સામાન્ય સભામાં સમયોચિત જરૂરી સુધારા વધારા તેમજ નવા ઠરાવો કરવાની આથી જ્ઞાતિજનો મંજુરી આપે છે.

**ઠરાવ નં. ૨ બોલામણા સંબંધે :**

બાળકના જન્મ પછી બોલાવવાના પ્રસંગે બાળકની માતાનાં સગા ભાઈ-બહેનો તથા કાકાઈ ભાઈઓએ જવાનું રહેશે. અન્ય કોઈ એ જવાનું નહીં અને આવા પ્રસંગે એક ટાંણાંથી વધુ રોકાવું નહીં.

**ઠરાવ નં. ૩ પછેડો આપવા સંબંધે :**

દીકરીને પહેલું બાળક જન્મે ત્યારે, તે નિમિત્તે પછેડો બન્ને પક્ષોની અનુકૂળતા પ્રમાણે આપવો.

**નોંધ :** ઠરાવ નં. ૨ અને ૩ બંન્ને પ્રસંગો શક્ય હોય ત્યાં સુધી સાથે યોજવા.

**ઠરાવ નં. ૪ સગપણ કરવા સંબંધે :**

(અ) બાળકોના તદ્દન નાની વયે સગપણ કરવા નહીં.
સગપણ કરવા માટે વય મર્યાદા નીચે મુજબ રહેશે
(૧) છોકરાની વય ઓછામાં ઓછી ૨૦ વર્ષ
(૨) છોકરીની વય ઓછામાં ઓછી ૧૭ વર્ષ



realpatidar.com

https://archive.org/details/bk299/page/n6/mode/1up



realpatidar.com

(બ) સગપણ કરતી વખતે દિકરાના માવિત્રોએ નીચે મુજબની વસ્તુઓ આપવી :

(૧) સોપારી નંગ - ૧

(૨) ટોપરા અથવા નાળિયેર નંગ - ૨

(૩) ગોળ અથવા મીઠાઈ

(૪) એક રૂપિયાનો સિક્કો શુભ શુકનનો ઉપર જણાવ્યા સિવાય પૈસાની કે બીજી કોઈપણ વસ્તુઓની લેતી દેતી કરવી નહીં.

(ક) સામસામે સગપણ કરવા નહીં.

(ડ) સોપારી સગપણ થયા બાદ કોઈપણ સંજોગોમાં થયેલ સગપણ ફોક કરવું જોઈએ નહીં.

**ઠરાવ નં. ૫ સગાઈ (ટીલા) સંબંધે :**

સગાઈ (ટીલા) સંબંધે દિકરાના માવિત્રોએ નીચે મુજબની વસ્તુઓ આપવી:-

(૧) કપડાની જોડી - ૧

(૨) ગોળ અથવા મીઠાઈ

(૩) શુભ શુકનના રૂપિયા ૫૧ (એકાવન) રોકડા

(૪) પગનાં સાંકળાં જોડી - ૧

(૫) નાકની સળી નંગ - ૧

(૬) આ પ્રસંગે વધારે રોકાવું નહીં ૩૫ વ્યક્તિઓએ જવું.

(૭) એક ટાણાંથી વધારે રોકાવું નહીં. (અતિ દૂરના સ્થળેથી આ પ્રસંગે આવનારે અનુકુળતા મુજબ વર્તવું.)

(૮) છોકરાને કોઈપણ સંજોગે ટીલા વિધી કરવી નહીં.

**નોંધ :** ઠરાવ નં. ૪-૫ શક્ય બને ત્યાં સુધી સાથેજ ગોઠવવા પરંતુ હસ્ત મેળાપના દિવસે કોઈપણ સંજોગોમાં ટીલા વિધી કરવી નહીં.



realpatidar.com

https://archive.org/details/bk299/page/n7/mode/1up



realpatidar.com

**ઠરાવ નં. ૬ તહેવારોના લાગા સંબંધે :**

સગપણ થયા પછીના આવતાં તહેવારનાં દિકરાના માવિત્રે લાગા (સપેતરૂ) દિવાળી પ્રસંગે રૂા. ૧૦૦/- તથા ત્યાર પછી હોળીના રૂા. ૫૦/- જન્માષ્ટમી પ્રસંગે રૂા. ૫૦/- મોકલવા.

**ઠરાવ નં. ૭ લગ્ન લખવા તથા વધાવવા સંબંધે :**

(૧) લગ્ન લખતી વખતે કન્યાપક્ષ લગ્નપત્રિકાના પુડામાં શુભ શુકન તરીકે રૂા. ૧૧/- મૂકવા.

(૨) લગ્ન વધાવતી વખતે વરપક્ષે શુભ શુકન તરીકે રૂા. ૧૧/- આપીને લગ્ન વધાવવું.

(૩) લગ્ન પત્રિકા વધાવવા લઈ જવા માટે કન્યાપક્ષ તરફથી બે માણસોએ વરપક્ષના ઘેર જવું અને તેઓએ એક ટાણું રોકાવું.

**નોંધ :** વધુ અંતરે હોય તો સંદેશા વ્યવહારનો ઉપયોગ કરી શકાય

**ઠરાવ નં. ૮ મામેરાં સંબંધે :**

(૧) મામેરામાં ભાણેજાને વાઘાના કપડાં વિગેરે તેમજ બહેનને તથા બનેવીને કપડાની જોડ આપવી, તે સિવાય બાકીનાઓને પહેરામણી બદલ રૂા. ૫૦/- રોકડા આપવા અને જમણ તેમજ દાગીના વગેરે બદલ મર્યાદિત રોકડ રકમ ગુપ્તપણે આપવી.

(૨) મામેરાની વળતરમાં ભાઈજે શાલ અને ભાભીને બ્લાઉઝ આપી શકાશે અને મામેરુ બેઠું ભરવું અને તેની જાહેરાત કરવી નહીં. મામેરામાં મર્યાદિત સંખ્યામાં જવું. નોંધ : મામાએ કન્યાને વાઘાનાં કપડામાં માત્ર પાનેતર, બ્લાઉઝ અને ચણીયો જ આપવાનો રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk299/page/n8/mode/1up



realpatidar.com

**ઠરાવ નં. ૯ લગ્ન (વિવાહ) સંબંધે :**

(૧) વર અને અણવર સિવાય જાનમાં વધારેમાં વધારે ૧૨૫ માણસો જઇ શકશે અને કન્યાપક્ષે જાનને એકટાણું જમાડવી.

**નોંધ :** બહુ દુરથી આવનાર જાનને અનિવાર્ય સંજોગો સમયે અનુકુળતા મુજબ વ્યવસ્થા કરી શકાય.

(૨) લગ્ન પ્રસંગે વરપક્ષે લાગા તરીકે નીચે મુજબ આપવાનું રહેશેઃ-

(ક) પોંખવાના રૂા. ૫૦/-

(ખ) પડલું ભરવું નહી વરપક્ષ જાન લઈને કન્યાપક્ષને ત્યાં કન્યા માટે ચુંદડી (ઘરચોળુ) સાથે કપડાની જોડી કન્યાને આપવાની રહેશે. જે પહેરીને કન્યા લગ્ન મંડપમાં આવશે.

(ગ) કાંકણની જોડી નંગ - ૧

(ઘ) મંગળ સૂત્ર - ૧

(૩) કન્યા પક્ષ તરફથી વરપક્ષને નીચે મુજબના લાગા આપવાના રહેશેઃ

(ક) જમાઇને રોકડા રૂા. ૨૫૦/- અથવા કપડાની જોડ

(ખ) વરના પિતાને રૂા. ૧૫૦/- અથવા કપડા

(ગ) વરની માતાને રૂા. ૧૫૦/- અથવા કપડા

(ઘ) વરના દાદાને રૂા. ૧૦૦/-

(ચ) વરની દાદીને રૂા. ૧૦૦/-

(છ) બાકીના કુટુંબીજનો (કાકા-કાકી, જેઠ-જેઠાણી વગેરે) દરેકને પહેરામણીના રૂા. ૫૦/- આપવા.

(જ) હેલને બદલે રૂા. ૨૦૦/- રોકડા આપવા.
લોણારીને રૂા. ૫૦/- રોકડા આપવા.

(ઝ) થાળી નંગ - ૧ અને વાટકો નંગ - ૧

(ટ) કન્યાદાનમાં પોતાની શક્તિ મુજબ રોકડું આપવું અને તેની જાહેરાત કરવી નહિ.

realpatidar.com

https://archive.org/details/bk299/page/n9/mode/1up



realpatidar.com

(૪) લગ્નવિધિ પૂરી થયા બાદ કન્યા વરના ઉતારે જાય ત્યારે નવવધુનો ખોળો ભરવામાં વરપક્ષ તરફથી મિઠાઈ આપવાની રહેશે.

(૫) નવ દંપત્તિને વરપક્ષ વાળા આશિર્વાદ આપી શકશે.

(૬) લગ્ન પ્રસંગે બન્નેપક્ષોએ ઇતર લાગા તરીકે નીચે મુજબ આપવાના રહેશે.

(ક) ઉમિયા માતાજીને ભેટ યથા શક્તિ મોકલવી.

(ખ) શ્રી મંદિરને ધર્માદાના રૂા. ૨૫/- (પચ્ચીસ)

(ગ) વરપક્ષ તેમજ કન્યાપક્ષે આ શુભ - પ્રસંગ નિમિત્તે શિક્ષણ ભેટ સમાજને મોકલવી અને ગોળ કરવી નહીં.

**નોંધ :**

(૧) આ પ્રસંગોમાં કોઈપણ જાતનો પ્રસાદ કે મુખવાસ વહેચવાનો નહીં તેમજ અનિચ્છનિય પ્રથા જેવીકે બારણું રોકવું, પગરખા છુપાવવા, ખોળામાંથી રૂપિયા ઉપાડવા વિગેરે જેવી પ્રથાઓ સદંતર બંધ કરવી.

(૨) નવ દંપત્તિની પ્રથમ દિવસે વર કન્યા દ્વારા સામસામે અપાતી ભેટ સોગાત કોઈપણ સંજોગોમાં આપવી નહીં.

(૩) નવ વધુને પિયરપક્ષ તરફથી મળેલ દાયઝો બતાવો નહીં.

(૪) કન્યા પક્ષવાળાએ વરપક્ષના અણવરોને કોઈપણ જાતની ભેંટ આપવી નહીં.

**ઠરાવ નં. ૧૦ સમૂહ લગ્ન સંબંધે :**

(૧) આપણી જ્ઞાતિમાં સમૂહ લગ્નો દર વર્ષે અનુકૂળતાએ થઈ શકશે.

(૨) કોઈપણ ગામ કે કુટુંબ સમૂહ લગ્ન (એક સાથે એકજ દિવસે લગ્ન) કરવા માંગતા હોય તો કોઈપણ ગામમાં બન્ને પક્ષ

realpatidar.com

https://archive.org/details/bk299/page/n10/mode/1up



realpatidar.com

વાળાએ વાંધો લેવો નહીં. આ સમૂહ લગ્નપ્રથાને જો કોઈ પણ તોડવા પ્રયત્ન કરે તો તેને કુટુંબ તથા ગામ સમજાવે અને જો ન સમજે તો તેને સહકાર આપવો નહીં.

(૩) સમૂહ લગ્નનો હેતુ સમય, શક્તિ, નાણાનો બચાવ અને સંગઠન ભાવના વધે તે માટે આયોજન કરવામાં આવે છે જેથી સભ્યોએ સમૂહ લગ્નમાં જોડાઈ સહકાર આપવો.

**ઠરાવ નં. ૧૧ આણાં સંબંધે :**

આણાંની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.

**ઠરાવ નં. ૧૨ પુનઃ લગ્ન સંબંધે :**

(૧) કોઈપણ બહેન વિધવા બને અથવા જ્ઞાતિ રીત મુજબ છુટાછેડા મેળવે તેનું પુનઃ લગ્ન થઈ શકશે.

(૨) આવા પુનઃ લગ્નનું સગપણ કરતી વખતે વરપક્ષ તરફથી રૂ. ૫૦/- ફેરવવાના રહેશે અને સગપણ નક્કી થયા બાદ તે રૂપિયા પ્રસાદી માટે આપવાના રહેશે.

(૩) આવા પુનઃ લગ્નમાં વર અને અણવર સિવાય વધારેમાં વધારે ૨૫ (પચ્ચીસ) માણસોએ જવું અને એક ટાણું જમવાનું રહેશે.

(૪) તદ્ઉપરાંત વરપક્ષે નીચે મુજબ કપડાં તથા દાગીના આપવાના રહેશે :-

(ક) કપડાની જોડી - ૧ કન્યા માટે

(ખ) નાકની સળી હેમની નંગ - ૧

(ગ) મઢેલું કંકણ નંગ - ૧

(ચ) પગના સાંકળા જોડ નંગ - ૧

આ ઉપરાંત દાગીના કે રોકડ રકમ આપવી નહીં.

(છ) પાછા પગના આણાં સદંતર બંધ કરવામાં આવે છે.

realpatidar.com

https://archive.org/details/bk299/page/n11/mode/1up



realpatidar.com

**ઠરાવ નં. ૧૩ છૂટા - છેડા સંબંધે :**

(૧) એક વખત સમજી વિચારીને લગ્નગ્રંથિથી જોડાયા બાદ છૂટા-છેડા લઈ શકશે નહીં. પરંતુ અનીવાર્ય સંજોગોમાં ઉપસ્થિત થતા પ્રશ્નોમાં કુટુંબો / સમાજો દ્વારા સમાધાનના પ્રયાસો સફળ ન નિવડે ત્યારે છુટા છેડા લઈ શકશે.

(૨) સમાજના કોઈપણ ભાઈએ એક પત્નીની હયાતીમાં બીજી પત્ની કરવી નહીં. કાનૂનના ઓથે રહી ''રખાત'' નામનું કલંકિત દૂષણ અપનાવી શકશે નહીં. એવું નિંદીત કાર્ય કરશે અથવા જે કોઈ સાથ સહકાર આપશે તેઓ પણ સામાજિક ગુન્હાને પાત્ર ગણાશે. આ કાર્ય કરનાર અને કરાવનાર પાસેથી સમાજ જરૂરી ખુલાસાઓ મેળવશે અને તે અંગે સમાજના નિયમની અવગણના કરનાર સાથે કોઈપણ સંગઠન કે સંસ્થાઓના સભ્યપદેથી દૂર કરવા જોઈએ. આવાં દૂષણો ન થાય તે માટે કુટુંબ પાંખડી કે ગામની તકેદારી સમિતિના સભ્યો અને કાર્યકર્તાઓએ તકેદારી રાખવાની રહેશે.

**ઠરાવ નં. ૧૪**

**મરણ પછીના ખર્ચ (દાડા) સંબંધે :**

(૧) મરનાર વ્યક્તિની ધાર્મિક વિધી બાદ બ્રાહ્મણો અને નીયાણીઓને જમાડવી પરંતુ તેરમું કરવું નહીં.

(૨) મરનાર વ્યક્તિ પાછળ તેના સ્મરણાર્થે કોઈ રકમ આપવા માંગતા હોય તો તેઓને સમાજના કેળવણી ફંડ, હોસ્પિટલમાં ફંડ અથવા એવા સામાજિક ઉન્નતિના કાર્યોમાં તે રકમ આપવા આ સભા ખાસ ભલામણ કરે છે.

**નોંધ :**

(૧) દૂરના સ્થળે રહેતા સંબંધીઓએ રૂબરૂ નહી જતાં સંદેશા વ્યવહારનો ઉપયોગ કરી શકશે.



realpatidar.com

https://archive.org/details/bk299/page/n12/mode/1up



realpatidar.com

(૨) અત્યારના સમયે બેસણાની વિધીના દિવસો શક્ય તેટલા ઘટાડી શકાશે.

(૩) મરણ બાદ અપાતી પાઘડી જેવી પ્રથાને સદંતર બંધ કરવી.

**ઠરાવ નં. ૧૫**

**કુદરતી ઘરભંગ થાય તે સંબંધે :**

(૧) દીકરીને સાસરાના ઘેર મોકલ્યા પછી મૃત્યુ પામે તો દીકરીને જીવીત સમય દરમિયાન આપેલ દાનની કોઈપણ વસ્તુ પાછી લેવી નહીં.

(૨) જમાઈનું મૃત્યુ થાય તેવા પ્રસંગે દીકરીના માવિત્રો તે દીકરીને ત્યાંથી લઈ જવા માગતા હોય તો દીકરીના માવિત્રોએ આપેલ દાગીના સિવાય બીજું કાંઈ પાછું લઈ જઈ શકશે નહીં. પરંતુ તે દીકરીને બાળકો હોય અને તે દીકરીના સાથે આવતા હોય ત્યારે માવિત્રો તરફથી અપાયેલ દાગીના અને દાયજો તેમજ સાસરા પક્ષે આપેલ દાગીના સાથે પરત આપવાના રહેશે. અને ન લાવતાં ત્યા છોડી આવવાના હોય તો તેવા પ્રસંગે દીકરીના માવિત્રોએ દીકરીને આપેલ દાગીના તથા અન્ય કોઈપણ વસ્તુ પાછી લઈ જઈ શકશે નહીં.

**નોંધ :** જમાઈનું મૃત્યુ થાય ત્યારે દિકરીને તાત્કાલીક ઘર મુકાવીને ઉઠાડી લેવાના બદલે તેના ભવિષ્યનો વિચાર કરવા બે માસનો સમય આપવો જોઈએ અને દિકરીના અભિપ્રાય મુજબ આગળનો નિર્ણય લેવો જોઈએ.

**ઠરાવ નં. ૧૬ શિક્ષિણ સંબંધે :**

(૧) આ સભા જ્ઞાતિજનોને ખાસ ભલામણ કરે છે કે... આ પ્રગતિશીલ યુગને અનુસરીને સૌ પોતાનાં બાળકો (પુત્ર-

realpatidar.com

https://archive.org/details/bk299/page/n13/mode/1up



realpatidar.com

પુત્રીઓ) ને ઉચ્ચ શિક્ષણ ફરજિયાત અપાવે. પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની ધગશ ધરાવનારને સમાજ અત્યંત ઉત્સાહ આપે છે. અને તેની કદર કરે છે.

(૨) સમાજે શરૂ કરેલ શિક્ષણ નીધી ફંડમાં ઉદાર હાથે ભેટ નોંધાવી જેથી જરૂરીયાત મંદ પરિવારના સંતાનોને શિક્ષણ નિધી દ્વારામદદ કરી શકાય.

(૩) દેશ-પરદેશમાં વસતાં સમાજના ભાઈ-બહેનોએ પોતાના ઘરમાં માતૃભાષા ગુજરાતી નો ઉપયોગ કરવો જોઈએ તેવી આ સભા ભલામણ કરે છે.

**ઠરાવ નં. ૧૭ લગ્ન વિધિ બાબત :**

દરેક ગામ, કંપાઓ તેમજ અન્ય સ્થળોએ લગ્નવિધિ અંગેની બ્રાહ્મણોની પદ્ધતી અલગ હોય છે. તેમાં અલગ-અલગ પદ્ધતિના કારણે મનદુઃખ ન થાય તે માટે સમાજે વિવાહ સંસ્કારની પુસ્તિકા પ્રકાશિત કરેલ છે. તે મુજબ જ દરેક જગ્યાએ લગ્નવિધિ કરવી જોઈએ તેવો સમાજ આગ્રહ રાખે છે.

**નોંધ :** (૧) સરકારશ્રીના નિયમો મુજબ લગ્ન નોંધણી ફરજીયાત હોવાથી રજીસ્ટ્રેશન ઓફીસે ફરજીયાત નોંધ કરાવવી.

૨) બ્રાહ્મણ અને બન્ને પરિવારોની ઉપસ્થિતીમાં સાદાઈ/ફુલહારથી થતા લગ્નો શાસ્ત્રોકત કરવા જોઈએ.

**ઠરાવ નં. ૧૮ બાહ્ય આચરણો અંગે :**

જ્ઞાતિમાં સંપૂર્ણ એકવાયતા જળવાય તે માટે કચ્છ-ગુજરાત અને ભારત તેમજ વિદેશમાં વસ્તા આપણાં સમાજમાં જ્ઞાતિજનોએ જન્મથી મરણોત્તર સુધીના સંસ્કારો હિન્દુ રીતરિવાજો મુજબ પાળવા (આચરવા) ના રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk299/page/n14/mode/1up



realpatidar.com

**ઠરાવ નં. ૧૯**

**સામાજિક તેમજ ધાર્મિક પ્રશ્નો અંગે :**

સમાજમાં ઉપસ્થિત થતા ધાર્મિક અને સમાજિક પ્રશ્નોનો સમાજ લેવલે નીરાકરણ લાવવા માટે અલગ પેટા નિયમો સાથેની કેન્દ્રીય સામાજીક ન્યાય સમિતિની નિમણૂંક કરવામાં આવેલ છે તેથી સામાજીક તેમજ ધાર્મિક પ્રશ્નો બાબત સમાજમાં મતભેદ ઉભા થાય તેવા સંજોગોમાં તેનો નિકાલ સામાજિક ન્યાય સમિતિ દ્વારા કરવો અને તે નિર્ણય અંતિમ રહેશે. કોર્ટનો આશરો લેવો નહીં.

નોંધ :- જ્ઞાતિજનોએ આ ઉપરોક્ત દરેક ઠરાવોનું પાલન કરવાનું રહેશે. અને જે કોઈ તેનું ઉલ્લંઘન કરે તો કોઈએ તેને સહકાર આપવો નહીં.

realpatidar.com

https://archive.org/details/bk299/page/n15/mode/1up



realpatidar.com

realpatidar.com